



## મહેસાણા શહેરની માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓના અનુકૂલનનો અભ્યાસ

DR. VARSHA B. PRAJAPATI  
Revaba Sarvajanik Education College, Mehsana

### ૧. સારાંશ

આજનો યુગ એ વિજ્ઞાન અને ટેક્નોલોજીનો યુગ છે. આ યુગમાં બાળકો બિન્દુ ક્ષમતા ધરાવતાં હોય છે. તે છતાં ઘણી વખત તેઓ શિક્ષણમાં નિરસતા દાખવે છે. પરિણામે તે માટે શિક્ષકને દોષિત ગણવામાં આવે છે. પરંતુ વાસ્તવમાં આવું હોતું નથી. આ પાછળ ઘણી બધી બાબતો અથવા પરિબળો અસર કરે છે. જેમ ડાર્વિનનો ઉલ્કાંતિવાદમાં જે સજુવ પોતાનું અનુકૂલન સાધે છે તે લાંબો સમય ટકે છે. આજ બાબત અહીં લાગુ પડે છે. માધ્યમિક શાળાનાં બાળકો તરફાવસ્થા ધરાવે છે. અચાનક સમય દરમ્યાન તેઓમાં જુદા જુદા ફેરફાર જોવા મળે છે. જેની અસર તેઓના અભ્યાસ પર જોવા મળે છે. આ પરિસ્થિતિનો સામનો કરવા માટે તેઓ કેવા પ્રકારનું અનુકૂલન સાધે છે. તેનો અભ્યાસ કરવા માટે આ સંશોધન પેપર હાથ ધરેલ છે.

### ૨. સમર્થ્યાક્થન શાળાની વ્યવહારું વ્યાખ્યા

A Study of Adjustment of Student Studying in Secondary School of Mehsana Taluka. “મહેસાણા શહેરની માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓના અનુકૂલનનો અભ્યાસ.”

### ૩. અનુકૂલનની વ્યાખ્યા

“અનુકૂલન એ એવી પ્રક્રિયા છે કે જે દ્વારા વ્યક્તિ પોતાની જત અને વાતાવરણ વચ્ચે સુસંવાદી સંબંધ સ્થાપવાના હેતુથી પોતાના વર્તનમાં પરિવર્તન લાવે છે.”

### ૪. અભ્યાસના હેતુઓ

- માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓમાં અનુકૂલનનો અભ્યાસ કરવો.
- માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓમાં ધોરણાના સંદર્ભમાં અનુકૂલનનો અભ્યાસ કરવો.
- માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓમાં જાતિના સંદર્ભમાં અનુકૂલનનો અભ્યાસ કરવો.

### ૫. અભ્યાસની ઉલ્કલ્પના

- ધોરણ-૮ અને ધોરણ-૮ના વિદ્યાર્થીઓના અનુકૂલનના પ્રાપ્તાંકોની સરાસરી વચ્ચે સાર્થક તફાવત નહીં હોય.
- માધ્યમિક શાળાના છોકરા અને છોકરીઓના અનુકૂલનના પ્રાપ્તાંકોની સરાસરી વચ્ચે સાર્થક તફાવત નહીં હોય.

૩. વિસ્તાર પ્રમાણે માદ્યમિક શાળાના વિદ્યાર્થીઓના અનુકૂલનના પ્રાપ્તાંકોની સરાસરી વર્ચે સાર્થક તફાવત નહીં હોય.

#### ૬. અભ્યાસની મર્યાદા

પ્રસ્તુત અભ્યાસ માત્ર મહેસાણા શહેરેના ધોરણ-૮ અને ધોરણ-૯ ગુજરાતી માદ્યમના તથા મહેસાણા શહેરના વિદ્યાર્થીઓ પૂરતો મર્યાદિત છે.

#### ૭. નિદર્શા પસંદગી અને ઉપકરણ

આ અભ્યાસ માટે દેસાઈ અનુકૂલન સંશોધનિકાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સંશોધનિકા રેઝન્ડ બાળકોને આપવામાં આવી.

ધોરણ-૮				ધોરણ-૯				કુલ	
શહેરી		ગ્રામ્ય		શહેરી		ગ્રામ્ય			
છોકરા	છોકરી	છોકરા	છોકરી	છોકરા	છોકરી	છોકરા	છોકરી		
૨૪	૨૬	૪૦	૫૮	૨૫	૩૩	૩૫	૪૦	૨૮૨	

#### ૮. માહિતી પૃથક્કરણની રીત

પ્રસ્તુત અભ્યાસમાં નિદર્શન એ પ્રાપ્તાંકોની સમધારણતા તપાસવા પ્રાપ્તાંકોના જુદા જુદા આવૃત્તિ વિતરણ બનાવવામાં આવ્યા અને t-ટેસ્ટ શોધવામાં આવી.

#### ૯. માહિતીનું પૃથક્કરણ જૂથ પ્રમાણે

જૂથ-૧	સંખ્યા	સરાસરી	પ્રમાણ વિચલન	t-ગુણોત્તર	પરિણામ
ધોરણ-૮	૧૪૮	૪૫.૬૫	૭.૫૬	૩.૨૫	ઉલ્કલ્પનાનો અસ્વીકાર
ધોરણ-૯	૧૩૩	૪૮.૬૫	૭.૬૫		
જૂથ-૨	સંખ્યા	સરાસરી	પ્રમાણ વિચલન	t-ગુણોત્તર	પરિણામ
છોકરીઓ	૧૫૮	૪૮.૬૨	૭.૦૨	૬.૫૮	ઉલ્કલ્પનાનો અસ્વીકાર
છોકરાઓ	૧૨૪	૪૪.૧૧	૭.૭૬		
જૂથ-૩	સંખ્યા	સરાસરી	પ્રમાણ વિચલન	t-ગુણોત્તર	પરિણામ
શહેરી	૧૦૮	૪૮.૬૫	૭.૮૫	૩.૨૫	૦.૦૧ કક્ષાએ સાર્થક
ગ્રામ્ય	૧૭૪	૪૫.૬૫	૭.૫૬		

ઉપરોક્ત કોષ્ટક પરથી ધોરણ-૮ અને ધોરણ-૯ના વિદ્યાર્થીઓના અનુકૂલનના પ્રાપ્તાંકોની સરાસરી ૪૫.૬૫ અને ૪૮.૬૫ તથા પ્રમાણ વિચલન ૭.૫૬ અને ૭.૬૫ છે. જેનો t-ગુણોત્તર ૩.૨૫ છે. માટે શુંચ ઉલ્કલ્પનાનો અસ્વીકાર થાય છે. એટલે કે ધોરણ-૮ અને ધોરણ-૯ના વિદ્યાર્થીઓના અનુકૂલનના સરાસરી પ્રાપ્તાંકોમાં ફેરફાર છે. ઉપરોક્ત કોષ્ટક પરથી છોકરીઓ અને છોકરાઓના અનુકૂલનના પ્રાપ્તાંકોની સરાસરી ૪૮.૬૨ અને ૪૪.૧૧ તથા પ્રમાણ વિચલન

૭.૦૨ અને ૭.૭૬ છે. જેનો t-ગુણોત્તર ૬.૫૮ છે. માટે શૂન્ય ઉત્કલ્પનાનો અસ્વીકાર થાય છે. એટલે કે છોકરીઓ અને છોકરાઓના અનુકૂલનના સરાસરી પ્રાપ્તાંકોમાં ફેરફાર છે. ઉપરોક્ત કોષ્ટક પરથી શહેરી અને ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓના અનુકૂલનના પ્રાપ્તાંકોની સરાસરી ૪૮.૮૫ અને ૪૫.૮૫ તથા પ્રમાણ વિચાળન ૭.૮૫ અને ૭.૫૬ છે. જેનો t-ગુણોત્તર ૩.૨૫ છે. માટે શૂન્ય ઉત્કલ્પનાનો અસ્વીકાર થાય છે. એટલે કે ગ્રામ્ય અને શહેરી વિસ્તારના વિદ્યાર્થીઓના અનુકૂલનના સરાસરી પ્રાપ્તાંકોમાં ફેરફાર છે.

## ૧૦. અભ્યાસનાં તારણો

ધોરણ-૮ અને ધોરણ-૮ના સમગ્ર વિદ્યાર્થીઓના સમગ્ર અનુકૂલનના પ્રાપ્તાંકોની સરાસરી જોતાં માલૂમ પડે છે કે ધોરણ-૮ના વિદ્યાર્થીઓ ધોરણ-૮ના વિદ્યાર્થીઓ કરતાં વધુ અનુકૂલન ક્ષમતા ધરાવે છે. ધોરણ-૮ અને ધોરણ-૮ના છોકરાઓ અને છોકરીઓના સમગ્ર અનુકૂલનના પ્રાપ્તાંકોની સરાસરી જોતાં માલૂમ પડે છે કે છોકરાઓ કરતાં છોકરીઓ વધુ અનુકૂલન ક્ષમતા ધરાવે છે. ગ્રામ્ય અને શહેરી વિસ્તારના વિદ્યાર્થીઓના અનુકૂલનના પ્રાપ્તાંકોની સરાસરી જોતાં માલૂમ પડે છે કે શહેરી વિસ્તારના વિદ્યાર્થીઓ ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ કરતાં વધુ અનુકૂલન ક્ષમતા ધરાવે છે.

## સંદર્ભસૂચિ

૧. દેસાઈ કે. જી., “શૈક્ષણિક મનોવિજ્ઞાન” જ્યભારત પ્રકાશન, અમદાવાદ.
૨. ત્રિવેદી, મનુભાઈ દ. અને ડૉ. ભગવાનલાલ ઉ. પારેખ “શિક્ષણમાં આંકડાશાંત્ર” યુનિ. ગ્રંથ નિમણા બોર્ડ, ગુજરાત રાજ્ય.
૩. Bernard H.W., “Psychology of Learning and Teaching”, New York, Mc-Graw Hill, 1954.